

Gujarat Lease Financing Limited

(CIN • L65990GJ1983PLC006345)

G/L/F/L

6th Floor, Hasubhai Chambers,
Opp. Town Hall, Ellisbridge,
Ahmedabad - 380 006.
Ph. : 079-2657 5722 / 2657 5180
E-mail : glllho_ahm@yahoo.co.in

Date: 29th January, 2021

To, Corporate Relationship Department BSE Limited 14th Floor, P. J. Towers, Dalal Street, Fort, <u>Mumbai-400001</u> SCRIP CODE: 500174	To, Listing Department National Stock Exchange of India Limited “Exchange Plaza”, C – 1, Block G Bandra - Kurla Complex, Bandra (East), <u>Mumbai – 400051</u> SCRIP SYMBOL: GLFL
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------	-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

Dear Sir/Madam,

Re : Newspaper publication of Unaudited Financial Results for the quarter and nine months ended on 31st December, 2020 u/r. 47(1) read with regulation 33 of SEBI(LODR) Regulations, 2015(“Listing Regulations”)

In compliance with regulation 47(1) read with regulation 33 of SEBI(Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose herewith the copies of the Newspaper advertisements published in Western Times, (English/Gujarati) edition on 28th January, 2021 in respect of Unaudited Financial Results of the Company for the quarter and nine month ended on 31st December, 2020 duly approved by the board at their meeting held on 27th January, 2021.

We request you to take this on record.

Thanking you,

Yours faithfully,

For Gujarat Lease Financing Limited



Kamlesh Patel
Company Secretary

OLED panel sales help LG Display swing to net profit in Q4

Seoul, LG Display on Wednesday said it shifted to a net profit in the fourth quarter of 2020, on the back of increased demand of its panels for IT products and sales of OLED displays amid the pandemic-induced stay-at-home trend.

LG Display reported a net profit of 621 billion won (\$561.2 million) for the Q4, following from a loss of 1.81 trillion won a year earlier.

Operating income for the fourth quarter was 685.5 billion won, compared with year ago, the company said in a regulatory filing. Sales rose 16.2 percent on-year to 7.46 trillion won.

For the whole of 2020, LG Display reported a net loss of 70.6 billion won, sharply narrowing from a net loss of 691.6 billion won a year ago.

Operating losses also narrowed to 29.1 billion won from 714.5 billion won, while sales rose 3.2 percent on-year to 24.23 trillion won in 2020.

Both operating profit and sales were higher than the market consensus of 377.3 billion won and 7.25 trillion won in a survey by Yonhap Infomax, the financial arm of Yonhap News Agency.

LG Display attributed its improved performance to increased demand of its display products amid the rising trend of remote working and distance learning caused by the novel coronavirus pandemic.

LG Display added that solid sales of OLED panels for TVs, supported by full operation of its plant in Guangzhou, China, and increased production of plastic OLED panels also helped the company to enhance its profitability.

By product, panels for IT products accounted for 37 percent of its revenue in the fourth quarter. TV panels accounted for 29 percent of its revenue, while mobile displays and other screen products made up 34 percent of its sales.

Apple launches limited edition 'Black Unity Collection' Watch

San Francisco, Apple has launched a limited-edition Watch for the 'Black History Month, with a unique band and a new face.

Available from February 1, the new hardware is part of what the company is calling the Black Unity Collection, a group of products designed to "celebrate and acknowledge Black history and Black culture."

Apple says the limited-edition Watch will be available in "over 38 countries and regions."

It hasn't yet confirmed international prices, but the \$399 Watch starts at 379 pounds or AU\$599.

The band will also be available separately for \$49. Apple Watch users can participate in a new 'Unity Activity Challenge' and earn the limited-edition award by closing their Move ring seven days in a row during February.

As part of this effort, Apple is supporting six global organisations to help advance their missions in promoting and achieving equality and civil rights in the US and around the world: Black Lives Matter Support Fund via the Tides Foundation; European Network Against Racism; International Institute on Race, Equality and Human Rights;

Leadership Conference Education Fund; NAACP Legal Defense and Educational Fund; and Souls Grown Deep.

In addition, Apple announced a number of other initiatives for Black History Month this year.

There will be a hub in the App Store highlighting Black-owned businesses in promoting and businesses and developers; Apple Music will get "curated playlists, essays, original videos" and other content highlighting Black artists; and Apple Maps is getting curated recommendations from EatOkra, which highlights Black-owned restaurants.

IIFL Securities appoints Sandeep Bhardwaj as CEO

Mumbai, IIFL Securities, one of India's leading broking and advisory firms has appointed Mr. Sandeep Bhardwaj as CEO- Retail Broking of the Company. In this role he will report to Mr. R Venkataraman, Chairman and Managing Director, IIFL Securities and Co-Promoter of diversified financial services group, IIFL. He will be based at Mumbai.

Sandeep was previously working with Angel Broking as the Chief Sales Officer and spent over a decade managing sales, revenue, and wealth management. Under Sandeep's leadership Angel Broking achieved market share of over 17% with 16 lac client acquisitions (CDSL) in the last twelve months. Angel also achieved leadership position in B2B segment and became No.1 in acquiring registered authorized persons.

Sandeep was instrumental in driving digital transformation and change management as customer centric innovation being key driver.

He has another decade of experience with Religare Finvest, Centurion Bank of Punjab, HDFC Bank and ICICI Group. Sandeep has done executive programs at INSEAD and Indian School of Business in the areas of leadership, marketing, analytics, and innovation.

Mr R. Venkataraman, MD, IIFL Securities Ltd., welcomed his appointment and said, "Sandeep, with his vast and varied experience in lending across multiple asset classes will drive our retail broking business to the next level of growth."

IIFL Securities has over a million retail customers, over 500 institutional clients and is the No.1 banker for Equity IPO over 2018-2020 period. It is also one of the pioneers in bringing technology-led innovations in the broking industry in India.

Twitter suspends 300 accounts after tractor rally went violent

New Delhi, Twitter on Wednesday said it suspended more than 300 accounts engaged in spam and platform manipulation as the farmers' tractor rally went violent in the national capital on the 72nd Republic Day.

The farmers swarmed the Red Fort and waved farmer union flags from its ramparts. They even hoisted farmer union flags as well as a pennant with a Sikh religious symbol from a flagpole.

A Twitter spokesperson told IANS that the company has taken strong enforcement action to protect the conversation on the service from attempts to incite violence, abuse and threats that could trigger the risk of offline harm by blocking certain terms that violate our rules for trends.

"Using a combination of technology and human review, Twitter worked at scale and took action on hundreds of Tweets that have been in violation of the Twitter Rules and suspended more than 300 accounts engaged in spam and platform manipulation," the spokesperson informed.

The Delhi Police on Sunday had warned that 308 Twitter handles have been generated to create confusion over the tractor rally proposed by protesting farmers on Republic Day.

"Through intelligence and various other agencies, we have continuously been getting inputs regarding a threat to create disturbance in the tractor rally. Nearly 308 Twitter handles have been generated from Pakistan to create confusion," said Dependra Pathak, Special Commissioner Police, Intelligence, Delhi Police.

The microblogging platform said they were monitoring the situation closely and remain vigilant, "and strongly encourage those on the service."

200M students, educators rely on our education products: Nadella

New Delhi, Driven by video conferencing platform Teams, more than 200 million students and educators worldwide now rely on Microsoft education products for remote learning, CEO Satya Nadella has stressed.

Speaking to analysts during the company's Q2 2021 earnings call, Nadella said that in AI, the company offers the most comprehensive portfolio of tools, frameworks and infrastructure.

"We built Teams that brings together multiple capabilities. It brings together chat. It brings together meetings, collaboration as well as business process workflow, all into one scaffolding," Nadella said on Tuesday.

"Whether it's SAP, ServiceNow and even Salesforce, all of these applications are getting integrated into Teams very rapidly and so that's the power of Teams as a platform capability, not just just knowledge workers collaborating," The Microsoft CEO stressed.

He said that the pandemic has shown the importance of empowering the two billion frontline workers around the world with the right technology and Teams is at the forefront.

Microsoft Teams reached more than 115 million daily users by the end of 2020.

Nadella said recently that Microsoft Teams could soon be as significant as the Internet browsers and operating systems.

Last week, enterprise application software provider SAP and Microsoft announced to integrate video conference and collaboration platform Teams with SAP's intelligent suite of solutions.

ADARSH PLANT PROTECT LTD
CIN No.: L29210GJ1992PLC017845
Regd. Office: 604, GIDC Estate, V. U. Nagar-388121, Anand, Gujarat.
Tel No.: (02692) 236705, Fax No.: (02692) 236704
Website: www.adarshplant.com Email: adarshplantprotect@gmail.com

Notice is hereby given that pursuant to Regulation 29 read with 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, a Meeting of the Board of Directors of the Company will be held on Saturday, 06th February, 2021, inter-alia to consider and approve, the Un-audited Financial Results for the quarter & nine months ended 31st December, 2020.

The said Notice is available on website of the Company i.e. www.adarshplant.com and also on the website of the BSE Limited i.e. www.bseindia.com.

For & on behalf of
Adarsh Plant Protect Ltd
Ami R. Mehta
Company Secretary

Date: 27th January, 2021
Place: V. U. Nagar

Microsoft logs 17% revenue growth riding on cloud business

San Francisco, An impressive growth in its Azure Cloud business in a pandemic-hit year helped Microsoft post a 17 per cent increase in its revenue which reached \$43.1 billion, with declaring a net income of \$15.5 billion, for the quarter ended December 31, 2020.

Microsoft stock rose as much as 6 per cent in extended trading on Tuesday. "What we have witnessed over the past year is the dawn of a second wave of digital transformation

sweeping every company and every industry," said Microsoft CEO Satya Nadella.

"Building their own digital capability is the new currency driving every organisation's resilience and growth. Microsoft is powering this shift with the world's largest and most comprehensive cloud platform," he said in a statement.

Revenue in Intelligent Cloud was \$14.6 billion and increased 23 per cent (on-year).

This immune cell in blood may up severe Covid risk

London, Researchers have found that patients with severe Covid-19 have significantly elevated levels of a certain type of immune cells in their blood, called myeloid-derived suppressor cells.

In the study, published in the Journal of Clinical Investigation, the team researched one type of immune cell, monocytic myeloid-derived suppressor cells, or M-MDSC, and their

potential role in Covid-19. "Our results help increase the understanding of what causes severe Covid-19 and is an important.

CHANGE OF NAME
I have changed my name from
PARMAR JAYESHKUMAR AMRUTLAL to new name
PATEL JAYESHKUMAR AMRUTLAL
Add.: 51, Rajeshwari Society, Nr. Suryadip Flat, Ranip, Ahmedabad-382480 B072

PUBLIC NOTICE
Take notice public at large that, Khyatiben Premkumar Patel residing at sola, Ahmedabad, have informed us that their title to the property particularly described in the schedule written herein are clear, marketable, and free from all charges, litigation, encumbrances. It has been also informed to us to inform public at large that, original Sale-Deed dated 09/09/2005 (19/09/2005) made in favor of Khyatiben Premkumar Patel, registered under sr. no.6800 was lost and / or misplaced and not traceable and also inform that such original document was not deposited with any persons, institutions or Banks with intent to create mortgage thereon. Take notice public at large that anybody having any right title, interest, claim or any other lien, charge or encumbrance etc. of any nature whatsoever, in or upon the said schedule property may inform the undersigned about the same and respect thereof within 7 days from the date hereof falling which it shall be presumed that nobody has any right, title, interest, claim lien, charge or encumbrance etc., of any nature whatsoever and if any that is waived of, in or upon the said schedule property and that upon the expiry of notice period, will render our opinion on title. **Schedule Above Referred** to All that piece or parcel of immovable property bearing Sub plot no.71 admeasuring about 53.53 Sq.mts. and construction admeasuring about 170.63 Sq.mts situated upon non-agriculture land bearing survey no.767/3,767/6,769/1 paiki,769/2 paiki,818/1 paiki,818/2, paiki,819/2 paiki,820/1, 821/1, 821/2, 821/3, 821/4 and 822,823/2 paiki allotted in lieu of Final Plot No.7 Town Planning Scheme No.40 of moje Sola, Registration District Ahmedabad and Sub-District Ahmedabad-2 (Wada)

Paras P. Patel (Advocate)
Office at-8, 2nd floor, Surya Complex, Opp. Golden Time, Swastik Char Rasta, Navrangpura, Ahmedabad.
Mo. 9428405420

GUJARAT STATE ROAD TRANSPORT CORPORATION
CENTRAL WORKSHOP NARODA, KRISHNANAGAR, AHMEDABAD-382345
ON-LINE E-TENDER NOTICE

GSRTC invites on-line tenders for purchase of M.S Flat, M.S. Perforated Sheet, Sun Visor Assembly, Door lock handle, Heavy Duty Extreme Sealing Tap, Front Wind Shield Laminated Curved & Clear Safety Glass for bus body building work (Due on 05.02.2021) from PSUs or Private firm as per Tender specification. For details regarding submission of tender documents through on line e-tender, please visit the following web site, www.nprocure.com; <http://gsrtc.nprocure.com>. A list of items and tender terms & conditions is available on GSRTC website www.gsrtc.in. For further details please contact on Mo. 6359918251, (Office) 079-29702226 during duty hours. Email:- wm_gsrtc@yahoo.com

No.INF/ABD/1345/2021 Works Manager C.W.A.

CHANGE OF NAME
I have changed my name from
NATHWANI SUMAN GIRDHARILAL to new name
NATHWANI PALAK GIRDHARILAL
Add.: A/804, Suryalok Tower, Sorabaji Compound, Juna Vada, Ahmedabad-380013 3032

CHANGE OF NAME
I have changed my name from
PRINCY KUMARI ARVINDBHAI CHRISTIAN to new name
PRINCY DOMINIC PRIMEAU
Add.: 301, Happy Home Appt, Maninagar East-380008 3031

BOARD MEETING
BISIL PLAST LIMITED

This is to inform you that the Board of Directors of the Company will meet on 5th February, 2021 for taking on record the Unaudited Financial Results for the quarter ended on 31st December, 2020.

SAKAR HEALTHCARE LIMITED

This is to inform you that the Board of Directors of the Company will meet on 5th February, 2021 for taking on record the Unaudited Financial Results for the quarter ended on 31st December, 2020.

PUBLIC NOTICE
BEFORE THE NATIONAL COMPANY LAW TRIBUNAL, AHMEDABAD
FORM NO. NCLT 3A
Notice of Petition
CP (CAA) No. 1/NCLT/AHM/2021
Connected with
CA (CAA) NO. 74/NCLT/AHM/2020

Casil Health Products Private Limited...Petitioner Company No.1
Karnavati Engineering Private Limited...Petitioner Company No.2
Inverika Bioresearch Private Limited...Petitioner Company No.3

A petition under section 230-232 of the Companies Act, 2013, was presented by Casil Health Products Private Limited, Karnavati Engineering Private Limited and Inverika Bioresearch Private Limited for sanctioning the Scheme of Amalgamation between Casil Health Products Private Limited, Karnavati Engineering Private Limited and Inverika Bioresearch Private Limited on 11.01.2021, and the said petition is fixed for hearing before Ahmedabad bench of National Company Law Tribunal on 23.2.2021.

Any person desirous of supporting or opposing the said petition should send to the petitioner's advocate, notice of his intention, signed by him or his advocate, with his name and address, so as to reach the petitioner's advocate not later than two days before the date fixed for the hearing of the petition. Where he seeks to oppose the petition, the grounds of opposition or a copy of his affidavit shall be furnished with such notice.

A copy of the petition will be furnished by the undersigned to any person requiring the same on payment of the prescribed charges for the same.

Dated this 28th day of January, 2021.

Sd/-
Thakkar and Pahwa, Advocates
(Advocate for petitioners)
Address: 71, New York Tower-A, Near Thalje Cross Roads, S.G. Highway, Ahmedabad-380 054.

GUJARAT LEASE FINANCING LTD.
(CIN: L65990GJ1983PLC006345)
Regd. Office: 6th Floor, Hasubhai Chambers, Opp: Town Hall, Ellisbridge Ahmedabad-380 006.
Ph: 079-26575722, E-mail: gflho_ahm@yahoo.co.in, Website: www.gujaratleasefinancing.co.in

Un-audited Financial Results for the Quarter and Nine months ended on 31st December, 2020
(₹ in Lacs except per share data)

Sl. No.	Particulars	Quarter ended	Nine Months ended	Quarter ended
		31.12.2020	31.12.2020	31.12.2019
		(Un-audited)	(Un-audited)	(Un-audited)
1	Total Income	0.07	1.13	0.84
2	Net Profit/(Loss) for the period (before Tax and Extraordinary items)	(9.16)	(29.65)	(4.92)
3	Net Profit/(Loss) for the period (after Tax and Extraordinary items)	(9.16)	(29.65)	(4.92)
4	Total Comprehensive Income for the period (after tax)	96.77	194.23	26.81
5	Equity Share Capital	2712.58	2712.58	2712.58
6	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of the previous year)	-	-	-
7	Earning Per Share (of ₹ 10/- each) Basic and Diluted	(0.03)	(0.11)	(0.02)

Notes:
1. The above is an extract of the detailed financial results for the quarter and nine months ended 31st December, 2020 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015. The full format of the same, along with the notes is available on the Stock Exchanges website at www.bseindia.com and www.nseindia.com and on Company's website: www.gujaratleasefinancing.co.in.

For Gujarat Lease Financing Limited
Saurabh Mashruwala
Director
DIN: 01786490

Place : Ahmedabad
Date : 27th January, 2021

Business Brief

Aadhar Housing Finance files for Rs 7,300 cr IPO

Mumbai, Blackstone-backed Aadhar Housing Finance Ltd has filed for an initial public offering worth up to Rs 7,300 crore.

The offering would include equity shares aggregating up to Rs 1,500 crore and shares of SHAR BANEGA, TOH DESH BANEGA.

There will be a hub in the App Store highlighting Black-owned businesses in promoting and businesses and developers; Apple Music will get "curated playlists, essays, original videos" and other content highlighting Black artists; and Apple Maps is getting curated recommendations from EatOkra, which highlights Black-owned restaurants.

A recent EY report showed that proceeds from initial public offerings (IPOs) in the country surged 61 per cent last year to over \$4.09 billion.

It said that the fourth quarter of 2020 saw a strong rebound in IPO activity and market sentiment remains positive.

Sensex down nearly 400 points

Mumbai, The key Indian equities declined on Wednesday morning with the BSE Sensex losing nearly 400 points, coming down from the 48,000 mark.

Heavy selling was witnessed in banking, finance and oil and gas stocks. Around 10.25 a.m., Sensex was at 47,954.05, lower by 393.54 points or 0.81 per cent from its previous close of 48,347.59.

It opened at 48,385.28 and has so far recorded an intra-day high of 48,387.25 and a low of 47,939.97. The Nifty50 on the National Stock Exchange was trading at 14,147.05, lower by 91.85 points or 0.65 per cent from its previous close.

Manish Hathiramani, technical analyst with Deen Dayal Investments said, "14,250 was a medium-term support for the index which was pierced on Monday. This makes the Nifty vulnerable and we can go down to 13,950 as a possible target."

"If we are unable to hold that level, we could fall further to 13,600. On the upside, the resistance is at 14,550-14,600 and until we do not close above that zone, we will continue to remain in the grip of the bears," he said.

Samsung to launch Galaxy M02 for less than Rs 7K next week

New Delhi, Expanding its entry-level smartphone segment in India, Samsung is set to launch another affordable smartphone billed as Galaxy M02 and priced under Rs 7,000 next week. Galaxy M02 is likely to have a large 6.5-inch infinity-V display and a dual camera setup at the back, industry sources told IANS on Wednesday.

After Galaxy M02s, this would be Samsung's second smartphone launched below Rs 10,000 this year. Earlier this month, Samsung launched its new budget smartphone 'Galaxy M02s' in the India market.

Galaxy M02s is priced at Rs 8,999 for the 3GB+32GB variant and Rs 9,999 for the 4GB+64GB variant. Galaxy M02s also comes with a 6.5-inch Infinity-V display for immersive viewing, content streaming, video calls and attending online courses. The device comes with 5000mAh battery along with 15W fast charging support.

Samsung's Galaxy M portfolio did extremely well in India, helping the company rise to top ranking in the third quarter last year. Designed for young millennial and Gen Z consumers, the 'M' series was launched in Q1 2019, and instantly became a hit in the country.

Over 10 lakh units of Poco M2 sold in India

New Delhi, Chinese smartphone brand Poco on Wednesday announced that it has sold over 10 lakh units of Poco M2 in the Indian market.

The device is priced at Rs 9,999 for the 64GB storage variant and the other variant with 6GB RAM and 128GB internal storage is priced at Rs 10,999.

"Accolades for POCO M2 started coming in early; in fact, Poco M2 is recognised as the bestselling phone online in the country, as per Counterpoint Market Research. With 6GB RAM, triple camera and more, Poco M2 has built a lot of salience for itself within a short span of time," the company said in a statement. Poco M2 features a 6.53-inch Full HD+ display, with a resolution of 2340X1080 and an aspect ratio of 19.5:9. The smartphone comes with a MediaTek Helio G80 octa-core processor with two Cortex-A75 cores at 2.0GHz and six Cortex-A55 cores at 1.8GHz, coupled with 6GB RAM and 128GB storage. The device houses a 13MP primary sensor, 8MP ultra-wide sensor, 5MP macro sensor and a 2MP depth sensor. There is also an 8MP selfie camera with night mode. The smartphone comes packed with a 5,000mAh built-in battery, powered with support for 18W fast charging (10W charger inbox).

TikTok to cut jobs in India after ban extends

New Delhi, About seven months after facing a ban in India, short video-sharing platform TikTok on Wednesday said it would scale down the size of its workforce constituting over 2,000 employees in the country.

TikTok featured among the 59 Chinese apps that the government has decided to permanently ban, and was one of the most popular.

The development came several months after the government had first banned Chinese apps temporarily in last June. "We have worked steadfastly to comply with the Government of India order issued on June 29, 2020. We continually strive to make our apps comply with local laws and regulations and do our best to address any concerns they have," a TikTok spokesperson said in a statement.

Samsung health tracking app soon in 31 more countries

Seoul, Samsung on Wednesday said its fitness app with advanced health tracking features will soon be available in 31 new countries as the South Korean tech giant tries to expand its health service amid the pandemic. The world's largest smartphone maker said the Samsung Health Monitor app received a Conformity to European (CE) marking in December 2020 and will be allowed to use in 28 European countries. The Samsung Health app made its debut in South Korea last year, and was also launched in Brazil and the United States, reports Yonhap news agency. The Samsung Health monitor app installed on the Galaxy Watch3 or Galaxy Watch Active 2 smartwatch offers blood pressure and electrocardiogram (ECG) tracking features, allowing users to easily monitor their health.

